



श्रुतदीप रिसर्च फाउंडेशननो संवाद-सेतु


श्रुतदीप

विक्रम संवत् २०७७ • वर्ष-४ • अंक-३ • ईश्रुआरी २०२१

कोरोनाथी बयवाना उपाय : जैन धर्मनी दृष्टिअे

मुनिश्री वैराग्यरतिविजय गण्डि

ई.स. २०२०नुं वरस कोरोना वायरसे जन्मावेला लयना ओथार डेठण वीत्युं. ई.स. २०२१मां पण कोरोनानो लय छवायेलो रडेशे, अेवुं अनुमान छे. कोरोना अतिसूक्ष्म विषाणु छे जे माणसना शरीरमां डेलाईने कोविड-१९ नामनी मारिनुं कारण बने छे. जे बिमारीमां अकण कारणोसर दईई जडपथी मृत्यु पामे अने जे बिमारीनुं संकमण बडु जडपथी थाय तेने मारि कडी शकय. कमनसीबे तेनी कोई रसी शोधाई नथी तेम ज तेने मडत करी शके अेवी दवा चिकित्साविज्ञान शोधी शक्युं नथी. (आ ज कारण तेनो लय सामान्य जनमानसने वधु परेशान करे छे.)



चिकित्सा विज्ञाननुं प्राथमिक लक्ष्य कोरोना वायरसने डेलातो डेवी रीते रोकी शकय अे छे. आ माटे ते विविध प्रयोगो करे छे. सायंस नेयर नामनी संस्थाअे थोडा समय पडेल थयेला आवा अेक प्रयोगनी विगत प्रसिद्ध करी छे. तेमनी अेवी पूर्वधारणा छती डे- जमती वभते डे वातथीत करती वभते अथवा भांसी डे छींक आवे त्यारे माणसना मोढांमांथी नीकणता लाण (Saliva)ना सूक्ष्म कणो कोरोनाना वाडक बने छे. (कोरोनानो विषाणु बडु सूक्ष्म छे. वैज्ञानिको अे तेनी अवगाहना २७ नेनोमिटर गण्णी छे. अेक सें.मी.ना डण्णरमां भागने १ नेनोमिटर कडेवाय कोरोनाना अेक विषाणुने २७००० गणो मोटो करो तो अेक सें.मी. थाय.) आटला सूक्ष्म कणोनी गतिविधि मापवा तेमणे विश्वना सडुथी जडपी इगाकू (FAGAKU) नामना परम संगणक यंत्र (सुपर कम्प्युटर) नो उपयोग कर्यो.

आ प्रयोगमां तेमणे यार माणसने मास्क पडेयां विना टेबल पर बेसाड्या अने मात्र अेक मिनिट माटे वातथीत करवा कहुं. सुपर कम्प्युटर द्वारा अे निरीक्षण कर्युं डे माणसना मोढांमांथी नीकणता लाणना सूक्ष्म कणो सडुथी वधु कई दिशांमां डेलाय छे. सुपर कम्प्युटर लाणना सूक्ष्म कणोनी ईमेज बनावी स्क्रीन पर दर्शावतुं छतुं. तेमणे जोयुं डे-सूक्ष्म कणो सीधी दिशांमां गति करे छे. अरोबर सामे बेसेली अने बाजुमां बेसेली व्यक्तिनी दिशांमां घण्णा बधा सूक्ष्म कणो गया. तेमां पण बाजुमां बेसेली व्यक्ति तरङ्ग जनारा कणोनी संभ्या सामे बेसेली व्यक्ति तरङ्ग जनारां कणो करता पांय गण्णी वधारे छती. तीरछी दिशांमां ४प डिग्री पर बेठेला व्यक्ति तरङ्ग जनारा सूक्ष्म कणोनी संभ्या योथा भागनी छती.

शास्त्रोमां (तत्त्वार्थसूत्रमां) अेवो उल्लेख प्राप्त थाय छे डे- पुद्गलो सीधी दिशांमां गति करे छे, विदिशांमां गति करता नथी. जैन शास्त्रोमां अतावे ल पुद्गलनी गतिनो आ नियम उपर कडेला



प्रयोगमां प्रत्यक्ष साबित थतो डेभाय छे. आ नियम मुजब माणसना मोढांमांथी नीकणता पुद्गलो कोरोना विषाणुनुं वडन करी शकता डोय तो कोरोनाना विषाणुथी बयवानो उपाय पण मणी शके. अेक, शक्य अेटलुं भोलवानुं ओछुं करो. बे, कोई भोलतुं डोय त्यां डण्णरी आपवानुं पण टाणो. त्रण, भोलवुं ज पडे तो भेस, मुडपत्ती डे वख मोढा सामे राणो. यार, वात करती वभते डे जमती वभते कोई व्यक्तिनी बाजुमां अथवा सामे बेसवानुं टाणो.

कोरोनानो बीजो अथवा त्रीजो डेलावो (2nd-3rd Wave) आववाना अेधाण छे त्यारे तेनी सामे सुरक्षाना उपायो विचारी लेवा जोईअे. कोरोनानुं पडेलुं मोजुं आव्युं त्यारे दुनियाने तेना विषे भबर न छती. परंतु ओघनिर्युक्ति नामना जैन शास्त्रमां आवा प्रकारनी बिमारीनुं नाम ते बिमारीथी त्रस्त बनेला दईईनी सारवार डेवी रीते करवी? तेनुं वर्णन छे. आ विषेनी माहिती उपर मुनिश्री त्रैलोक्यमंडनविजयज्जम. अे सरस प्रकाश पाथर्यो छतो.



जैन धर्ममां अेवा डेटलाय प्रिकोशन्स नियमो छे जे तमने कोईपण वायरसथी बयावी शके छे. अेक वात भ्यालमां राणवा जेवी छे डे- बधा ज वायरस रोग पेदा नथी करता. डेटलाक वायरस तो शरीरना स्वास्थ्य माटे जरुरी पण छे. माणसना शरीरने डानि पडोयाडनारा वायरसथी बयवा माटे बडु ज जरुरी बे उपाय छे. अेक, ते वायरस कोई पण रीते शरीरनी लीतर जतो न रडे. अने बे, डानिकारक वायरस आपण्णा द्वारा डेलाय नई तेनी तडेदारी राणवी. कोरोनाना डेसमां आ बने उपायो योजवामां आव्या छता. मास्क, सेनेटाईजेशन वि. पडेलो उपाय. अने सेल्फ क्वोरन्टाईन बीजो उपाय.


अही अे प्रश्न उठी शके डे - डानिकारक वायरस डेलावतो आपण्णे डेवी रीते रोकी शकीअे?

आ सवालनो जवाब जैन धर्मना नियमोना परिप्रेक्ष्यमां समज्जअे. वायरस डेलाववामां सडुथी मोटो भाग लजवे छे- मनुष्यना शरीरमांथी नीकणता उत्सर्जन (बायप्रोडक्ट्स). पसीनो, मण, मूत्र, नभ, कान-नाकनो मेल, लाण, वि. वायरसना संवाडको छे. मूलभूत रीते कोईपण वायरस पशुमांथी मनुष्यमां जल्ले संकांत थतो नथी. पण मनुष्यनो वायरस बीज मनुष्यमां बडु जल्ले संकांत थाय छे. अने तेमां बे तत्व मोटो भाग लजवे छे. अेक, मनुष्य शरीरना उत्सर्जन (थूक, पसीनो वि.) अने पाणी.

जैन धर्ममां अेम कहुं छे डे- मनुष्य शरीरना उत्सर्जनोमां ४८ मिनिटमां लाणोनी संभ्यामां सम्मूर्च्छिम पंयेद्रिय मनुष्य पेदा थाय छे. आने थोडुं

સમજાએ. આપણાં શરીર લાખો-કરોડો જીવિત કોષોથી બન્યું છે. વિજ્ઞાન એમ કહે છે કે- શરીરમાં ૩૦ ટ્રિલિયન - ૩ અબજ જીવિત કોષો છે. આ દરેક કોષોમાં ૧.૪ વોલ્ટેજ જેટલી શક્તિ છે. શરીરમાં સતત નવા કોષો બનતા રહે છે. સાત વરસમાં બધા જ કોષો બદલાઈ જાય છે. હવા, પાણી, વાતાવરણ, ખોરાક, શ્વાસ, શબ્દ વિ. દ્વારા આપણે જે પ્રાણ શક્તિ લઈએ છીએ અને તેના દ્વારા નવા કોષો બનાવીએ છીએ. જૂનાં કે નવા ઝેરી કોષોને શરીર ઉત્સર્જન દ્વારા બહાર ફેંકે છે. આ કોષોમાં થોડો સમય સુધી પ્રાણ શક્તિનો પ્રભાવ રહે છે. (વધુમાં વધુ ૪૮ મિ. સુધી) ત્યાર પછી તેમનું વ્યુત્સર્જન (ડિકંપોઝિંગ) થવા લાગે છે. આ અવસ્થામાં જો તેમને પ્રાણ શક્તિનો બીજો સ્ત્રોત મળી જાય તો તે કોષો ફરી સક્રિય થાય છે. તે મનુષ્યના જીવિત શરીર કોષો જેવું જ કામ કરે છે. પરંતુ તેમનો ચેતના સાથે સંપર્ક હોતો નથી તેથી આ કોષોમાં જ્ઞાનશક્તિ હોતી નથી. તેમને બ્રેનડેડ સેલ્સ કહી શકાય. તેમની તમામ ક્રિયાઓ મનુષ્યના સેલ (કોષ) જેવી જ હોય છે પણ તેમને મનુષ્યના મગજના આદેશો મળતા નથી. આવા કોષો વાયરસ, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોના સંવાહક બને છે. અને બીજા મનુષ્યના સંપર્કમાં આવતા જ તેમનામાં સંક્રમણ કરે છે. તેમનામાં રહેલા વિષાણુ, સ્પર્શથી, નાક દ્વારા, મોંઢા દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે.

આમ, મનુષ્ય શરીરના ઉત્સર્જનો (મલ-મૂત્ર વિ.) વાયરસના સશક્ત સંવાહક બને છે. તેમના દ્વારા થતું સંક્રમણ અટકાવવા માટે જૈન ધર્મે કેટલાક નિયમો બનાવ્યા છે. જૈન પરિભાષા મુજબ ૪૮ મિનિટ પછી મનુષ્ય શરીરના મળ વિગેરેમાં સમ્મૂર્ચિત જીવો ઉત્પન્ન થાય છે અને તે સૂકાય નહીં ત્યાં સુધી તેમની પુનરુત્પત્તિ (રિપ્રોડક્શન)ની પ્રક્રિયા ચાલતી રહે છે. પાણી અને ભેજ



તેમની પુનરુત્પત્તિની પ્રક્રિયામાં બહુ મદદ કરે છે. તેની પર બેસતાં જીવ જંતુઓ, માખી-મચ્છર વિગેરે પણ તેનું સંક્રમણ ફેલાવે છે.

આ સંક્રમણ અટકાવવાનો પહેલો રસ્તો એ છે કે- મનુષ્યના શરીરના ઉત્સર્જનો

પાણી કે ભેજના સંપર્કમાં ન આવે અથવા તુરત સૂકાઈ જાય તેનું ધ્યાન રાખવું. બીજો તેના સંવાહકોથી બચાવે તેવા પ્રિકોશન્સ લેવા.

આ બાબતને ધ્યાનમાં રાખીને જૈન ધર્મમાં કેટલાક સામાન્ય નિયમો પાળવામાં આવે છે.

૧) પાણી દ્વારા સંક્રમણ થતા વિષાણુ કે બેક્ટેરિયાથી બચવા પાણી ઉકાળીને જ પીવું. ઉકાળતાં પહેલાં પણ તે પાણીને બરાબર જાડા કપડાંથી ગાળી લેવું (ફિલ્ટર કરવું) પાણી જો લાંબો સમય પડ્યું રહે તો તેમાં ફરી પાછી પુનરુત્પત્તિની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. માટે દર નવથી પંદર કલાકે પાણી ફરી ઉકાળવું. ઉનાળામાં પંદર કલાકે, શિયાળામાં બાર કલાકે અને ચોમાસામાં નવ કલાકે પાણી ઉકાળવું. આમ પાણી ઉકાળીને પીવાનો નિયમ કોરોના કે અન્ય વાયરસથી બચાવી શકે છે.

૨) એકબીજાનું એટું ખાવું નહીં. માણસ કોઈ વસ્તુ ખાય ત્યારે તેની લાળ તેમાં ભળે છે. આ લાળમાં વાયરસ હોઈ શકે છે. એકબીજાનું એટું ખાવાથી વાયરસનું સંક્રમણ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

૩) જમવાની થાળી પણ તરત જ જાતે ધોઈને ચોક્ખી કરવી અને તેનું પાણી બહાર ફેંકવું નહીં. થાળીમાં એટું અનાજ પડ્યું રહે તો માણસની લાળ સાથે આવેલા કોષોમાં વાયરસ વધવા માંડે છે. સમય જતાં તેની સંખ્યા વધતી જાય છે. એટું વાસણ ધોયા પછી તેના પાણીમાં પણ સંવાહક કોષો જીવતા રહે છે. માટે જ જૈનોમાં થાળી ધોઈને પીવાનો નિયમ છે.

૪) કોઈનું એટું પાણી પણ પીવું નહીં. પાણી પી લીધા પછી ગ્લાસ

કપડાંથી કોરો કરી નાંખવો.

૫) રાંધેલું અનાજ વધુ સમય રાખવું નહીં. વાસી ખોરાકમાં પાણીનો અંશ હોય છે તે જૈવિક ઉત્પત્તિ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અનાજ ઢાંકેલું રાખવું. જેથી તેની ઉપર માખી-મચ્છર વિ. બેસે નહીં. ફિજમાં રાખેલી કોઈ પણ વસ્તુ વાયરસની સંવાહક બની શકે છે. તાજ સ્વચ્છ હવાની અવરજવર હોય તેવા સ્થાનમાં રહેવું.



૬) શરીરના કોઈ પણ પ્રકારના ઉત્સર્જનોને પાણીના સંપર્કમાં આવવા દેવા નહીં. તે તરત સૂકાઈ જાય તે રીતની વ્યવસ્થા ગોઠવવી.

૭) બંધિયાર (Humidity) વાતાવરણમાં વાયરસ ફેલાવાની શક્યતા વધુ હોય છે. ઓફિસમાં કે બીજો જાહેર સ્થળોમાં આ સૂક્ષ્મ લાળ કેવી રીતે ફેલાય છે તેનો પણ વિજ્ઞાને પ્રયોગ કર્યો. ઓફિસમાં લગભગ બંધિયાર વાતાવરણ હોય છે તેથી હવાની અવરજવર હોતી નથી તેને કારણે રોકાયેલી હવામાં ભેજ (Humidity) વધુ હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૦ ટકા હોય ત્યારે કોઈ માણસ માસ્ક પહેર્યા વિના સાધારણ ખાંસી ખાય, તો સહુથી વધુ માત્રામાં વિષાણુઓ બાજુ વાળા માણસ પર આક્રમણ કરે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકાથી વધુ હોય તો આ વિષાણુઓનું પ્રમાણ બમણું થઈ જાય છે.

માટે ઓફિસમાં સામ-સામે બેસનારા માણસ વચ્ચે પાટિયું રાખવું આવશ્યક છે. આ રીતે ફેલાતા લાળના સૂક્ષ્મ કણોનો વિડિયો પણ તેમણે લીધો છે.

આ જ રીતે તેમને ટ્રેન, બસ, માર્કેટ, ક્લાસરૂમમાં પણ પ્રયોગ કરી જોયા. તેમાં એ તારણ નીકળ્યું કે- ફેસ શિલ્ડ, માસ્ક જેટલા અસરકારક નથી. કેમ કે - ફેસ શિલ્ડ સૂક્ષ્મ કણોને ફેલાતા રોકી શકતા નથી, કેવળ તેમની દિશા બદલે છે.

બાજુમાં બેસીને જમવાથી વાયરસનો ચેપ લાગવાનો વધુ ખતરો છે. સામેની બાજુ તેમાં પણ એકદમ સામે નહીં પણ સહેજ બાજુમાં બેસવાથી ખતરો ઓછો છે.

૮) કોઈની સાથે વાત કરતી વખતે વચ્ચે એક કપડું (માસ્ક, ખેસ મુહપત્તી) અવશ્ય રાખવી, ઘર બહાર નીકળતાં ખેસ અને પાઘડી રાખવા જ.

૯) ઘરની બહારના અન્ય વ્યક્તિ સાથે વાત કરતા અંતર રાખવું.

જૈન શાસ્ત્રોમાં બતાવેલ આ નિયમોનું પાલન કરવાથી જીવોની હિંસાના પાપથી પણ બચાય છે અને રોગથી સુરક્ષા પણ મળે છે. આમ આ નિયમો શારીરિક અને આધ્યાત્મિક ઉભય રીતે લાભદાયી છે.

આ લેખને તપાસીને શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક સૂચનો કરવા બદલ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય દિવ્યકીર્તિસૂરિજી મહારાજ (આ.શ્રીરામચંદ્રસૂરિ સમુદાય), પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય યશોવિજયસૂરિજી મહારાજ (આ.શ્રીપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાય) તેમ જ ડૉ. જિતેન્દ્ર બી. શાહ નો ઋણી છું.

સંદર્ભ - fb.com.science nature page/ E223

અનેકાંતવાદ- વર્તમાન સંદર્ભમાં

દર મહિનાના છેલ્લા શનિવારે રાત્રે ૮.૩૦ ક. વિવિધ વક્તાઓ દ્વારા અનેકાંતવાદ વિષયને અનુલક્ષીને વ્યાખ્યાન પ્રસ્તુત થાય છે.

જિજ્ઞાસુઓ WhatsApp નંબર ૭૭૪૪૦૦૫૭૨૮ પર સંપર્ક કરી જોડાઈ શકે છે.

મૌન એકાદશી

મુનિશ્રી વૈરાગ્યરતિવિજય ગણિ

મૌન એકાદશીની સાધના ત્રણ સ્તરે થાય છે. એક, આ દિવસે નામની સાધના કરવાની છે. બે, નમનની સાધના કરવાની છે અને ત્રણ, મૌનની સાધના કરવાની છે.

કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ સકલાહર્ત સ્તોત્રમાં કહ્યું છે કે - પરમાત્મા વિશ્વને ચાર માધ્યમો દ્વારા પવિત્ર કરે છે. એક, પોતાના નામના માધ્યમે, બે, આકૃતિ કે મૂર્તિના માધ્યમે, ત્રણ, અલગ અલગ અવસ્થા દ્વારા અને ચાર, ભાવ દ્વારા. ભગવાનની ઉપકારકતાને ક્ષેત્ર અને કાળનાં બંધન નડતા નથી. આજે દ્રવ્ય કે ભાવ રૂપે ભગવાનનો અનુગ્રહ ઝીલવાનું ભાગ્ય આપણી પાસે નથી. નામ કે આકૃતિ રૂપે છે. આકૃતિના પણ અમુક બંધનો છે. નામની સાધના વ્યાપક સ્તર પર થઈ શકે છે.

આજનો દિવસ ભગવાનનાં નામને યાદ કરવાનો છે. દોઢસો ભગવાનના કલ્યાણકથી આજની તિથિ પાવન બની છે. દસ ક્ષેત્ર અને ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળના તીર્થંકર ભગવંતોના પાંચ-પાંચ કલ્યાણક આજે સંપન્ન થયા છે. આ દરેક ભગવાનનું નામ સ્મરણ કરવાથી ભગવાનનું સામીપ્ય અનુભવાય છે.

ભગવાનનું સામીપ્ય કરુણાનો સ્પર્શ કરાવે છે. કરુણાના સ્પર્શે પ્રસન્નતાનો અનુભવ થાય છે. ભગવાનના ઉપકારો યાદ આવે છે. અને ભગવાનના ચરણે આપોઆપ 'નમન'નો ભાવ જન્મે છે. 'નમન' મૌન એકાદશીની સાધનાનો બીજી રીત છે. નમન એટલે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાથી અભિવ્યક્તિ. ભગવાનની સ્તુતિ, સ્તવન, દેવવંદન કરવા દ્વારા ભગવાનની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર આજની તિથિ આપે છે.

આજની તિથિને મૌન એકાદશી કહે છે. મૌન એટલે બોલવું નહીં એ



અર્થ આપણે સમજીએ છીએ પરંતુ એ અધૂરો છે. મૌન શબ્દ સંસ્કૃત છે તે મુનિ શબ્દમાંથી બને છે. મૌન એટલે મુનિનો સ્વભાવ. મુનિનો સ્વભાવ છે-કોઈ પણ ઘટનાનો પ્રતિભાવ (Reaction) ન આપવો. આપણાં મનમાં હજારો વિચારો ચાલતા હોય છે. વિચાર સારા પણ હોતા નથી વિચાર ખરાબ પણ હોતા નથી. વિચાર, વિચાર હોય છે. આપણે દરેક

વિચાર સાથે લાગણીને જોડીને વિચારને સારો અથવા ખરાબ બનાવીએ છીએ. મુનિઓ વિચાર અને લાગણીને અલગ રાખે છે. તેમની ભેળસેળ થવા દેતા નથી. લાગણી પ્રતિભાવને જન્મ આપે છે. પ્રતિભાવની પરંપરા ચાલે છે. મુનિનો એ સ્વભાવ છે મનને 'નોન-રિએક્ટીવ મોડ'માં લઈ જવું. મનને પ્રતિભાવ આપવાની આદતથી મુક્ત કરવું તેનું નામ મૌન છે. આ કામ આસાન નથી. પ્રતિભાવની આદતથી મુક્ત થવાના બે રસ્તા છે. એક, મનને કોઈ ન્યૂટ્રલ વિષયમાં જોડી દેવું. બે, જે વિચારો આવે છે તેનો સ્વીકાર કરવો. લાગણીથી મુક્ત બનવાનો અભ્યાસ કરવો.

આ બંને વાત ધ્યાનથી શક્ય છે. થોડો સમય માટે મનને ભગવાન સાથે, ગુરુ સાથે કે સારા વિચારમાં જોડી દેવાથી મન તેટલો સમય પ્રતિભાવ આપતું બંદ થઈ જાય છે. મંત્રનો જાપ કરવાથી, પૂજા, ભક્તિ, સેવા કરવાથી પણ મનની પ્રતિભાવ આપવાની આદત દૂર થાય છે.

બે, શાંતિથી એક જગ્યાએ બેસીને વિચારોનું નિરીક્ષણ કરવું. મનમાં જે



વિચાર આવે છે તે વિચારની નોંધ લેવી અને તેની સાથે જોડાયેલી લાગણી છે તેની નોંધ લેવી. વિચાર અને લાગણી બંનેને અલગ (Separate) કરવાનો અભ્યાસ કરવો.

ધીરે ધીરે મનની પ્રતિક્રિયા આપવાની આદત ઓછી થશે અને મૌનનો અનુભવ થશે. મૌન, આત્મશાંતિનું પ્રવેશદ્વાર છે. જીવનમાં શાંતિ અનુભવાશે.

મૌન એકાદશી આ ત્રણ સંદેશ આપે છે. એક, ભગવાનનું નામ લેતા રહો તેનાથી નમનનો ભાવ જન્મશે. બે, ભગવાનને નમન કરતા રહો તેનાથી ન-મન (No-Mind) નો ભાવ જન્મશે. મનની લાગણી સાથે વહી જવાની આદત છૂટશે. ત્રણ, મન લાગણીથી મુક્ત થશે તો આપોઆપ શાંત થશે.

આચારંગ સૂત્રમાં એક સરસ વાત કહી છે-

જે મોળં તિ પાસહા તં સમ્મંતિ પાસહા ।

જે મુનિની નજરથી જૂએ છે તે જ સાચું જુએ છે.

નામ, નમન અને મૌનના સહારે જીવનમાં પરમ શાંતિ અવતરે એ શુભકામના.



પદાર્પણ

શ્રુતભવનમાં પૂ. આ. શ્રી જગચંદ્રસૂ. મ.સા., પૂ. આ. શ્રી ચંદ્રભૂષણસૂ. મ.સા., પૂ. સા. શ્રી ઉદ્યોતદર્શનાશ્રીજી મ.સા., શ્રી લલિત ગાંધી (રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય જૈન અલ્પસંખ્યાક મહાસંઘ), શ્રી સંકેતજી મુણોત (સંસ્થાપક, Understanding Jainism Group), શ્રી સુરેશજી જૈનનું પદાર્પણ થયું.

સમાચાર

તા. ૧૯-૧૧-૨૦૨૦ ના દિવસે પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં, શ્રુતભવનમાં બ્રાહ્મી લિપિ પૂજન અને જ્ઞાનપાંચમ દેવવંદનનો કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.

તા. ૩૦-૧૧-૨૦૨૦ ના દિવસે પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં, શ્રુતભવનમાં કારતક પૂનમનો કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો.

તા. ૨૫-૧૨-૨૦૨૦ ના દિવસે પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં, શ્રુતભવનમાં મૌન એકાદશી પર્વ આરાધનાનો કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.

તા. ૦૮-૦૧-૨૦૨૧ ના દિવસે પોષ દશમી, પાર્શ્વનાથ પ્રભુ જન્મકલ્યાણક નિમિત્ત વિશિષ્ટ અભિષેક સંપન્ન થયા.

કાર્યવિવરણ

શાસ્ત્ર સંશોધન પ્રકલ્પ અંતર્ગત લોકપ્રકાશ, પૃથ્વીચંદ્રચરિત્ર, અરિષ્ટનેમિજનચરિત, પ્રવચનવિચારસાર, ઋજુપ્રાણવ્યાકરણ, નવતત્ત્વપ્રકરણ સહ ટીકા અને નામમાલા સહ ટીકાનું સંપાદન કાર્ય ચાલુ છે.

- પૂ. સા. શ્રી મધુરંસાશ્રીજી મ. પ્રદેશી રાજા ચરિત્રનું લિપ્યંતર કરે છે.
- પૂ. સા. શ્રી. ધન્યહંસાશ્રીજી મ. પર્યુષણચિંતામણિ પ્રકરણ સહ ટબાર્થનું લિપ્યંતર કરે છે.

વર્ધમાન જિનરત્નકોશ પ્રકલ્પ અંતર્ગત પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂ. મ.સા., પૂ. આ. શ્રી હેમપ્રભસૂ. મ.સા., પૂ. આ. શ્રી હર્ષવર્ધનસૂ. મ.સા., પૂ. આ. શ્રી અભયદેવસૂ. મ.સા., પૂ. આ. શ્રી મહાબોધિસૂ. મ.સા., પૂ. મુ. શ્રી મેહુલપ્રભસાગરજી મ.સા., પૂ. મુ. શ્રી મુકિતશ્રમણવિ. મ.સા., પૂ. મુ. શ્રી રૈવતભૂષણવિ. મ.સા., પૂ. મુ. શ્રી શ્રુતતિલકવિ. મ.સા., પૂ. મુ. શ્રી પ્રશાંતવલ્લભવિ. મ.સા., પૂ. ગ. શ્રી સુયશચંદ્રવિ. મ.સા., પૂ. સા. શ્રી હર્ષિતગુણાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી કુમુદરેખાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી સંબોધિજી મ.સા. તથા શ્રી કેવલ મેહતાને હસ્તપ્રતસંબંધિ માહિતી પ્રદાન કરવાનો લાભ મળ્યો.

પ્રાચીન શ્રુતસંપદાના સમુદ્ધાર અર્થે સમુદાર સહયોગ આપનારા મહાનુભાવ

- | | |
|--|--|
| <ul style="list-style-type: none"> ● શ્રી નલિનકાંત જેવતલાલજી દલાલ, પુણે ● શ્રી અભૂષા ફાઉન્ડેશન, ચેન્નઈ ● શ્રી સુધીરભાઈ સુંદરલાલ કાપડીયા, મુંબઈ ● સૌ કલ્પનાબેન સુધીરભાઈ કાપડીયા, મુંબઈ ● પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી હરહરવાલા બિલ્ડિંગ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ ● શ્રી વાસુપૂજ્યસ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુરાદ સોસાયટી, પુણે ● સૌ સોનાલીબેન ભુપેંદ્રકુમાર જૈન, દાપોલી ● સૌ ભારતીબેન મોતીલાલ જૈન, સાતારા ● સૌ રેખાબેન અશોકભાઈ કોઠારી, મુંબઈ ● શ્રી વિલાસકુમારજી પુનમચંદજી નાણેશા, સાતારા | <ul style="list-style-type: none"> ● શ્રી સ્થાનકવાસી છ કોટી લિંબડી અજરામર સંપ્રદાય, મુંબઈ ● શ્રી અશોકભાઈ અચલચંદજી હિંગડ (જૈન), પુણે ● Tiam Cosmetics, Mumbai ● શ્રી હસમુખભાઈ શાહ, મુંબઈ ● શ્રી વૈભવ પ્રકાશજી ધોકા, પુણે ● સૌ. અદિતિબેન સાગરભાઈ શાહ, પુણે ● શ્રી મૂળરાજજી વ્હી. સંઘવી, મુંબઈ ● શ્રી વિલાસ શાંતિલાલજી ભંડારી, પુણે ● સૌ કવિતાબેન રિતેશભાઈ કોઠારી, પુણે ● શ્રી સિદ્ધાર્થ રતિલાલ શાહ, પુણે ● શ્રી અશ્વિનભાઈ અમૃતલાલ સંઘવી, પુણે ● શ્રી નિરવભાઈ પ્રતાપભાઈ શાહ, મુંબઈ ● હિતેશ સ્ટીલ કાર્પોરેશન (દીપકભાઈ), મુંબઈ |
|--|--|

પ્રતિભાવ

પૂજ્ય ગુરુદેવનું પ્રગલ્ભ જ્ઞાન, અભ્યાસ અને જૈન ધર્મની જ્ઞાનવારસાની દીર્ઘકાલીન સુરક્ષા માટે તેમના વિચાર અત્યંત મહત્ત્વપૂર્ણ અને અનુકરણીય છે. ટ્રસ્ટ મંડળનું કાર્ય વંદનીય છે. આ કાર્યના પ્રચાર-પ્રસાર અને વિસ્તાર માટે મને યોગદાન કરવાનો અવસર મળશે તો મારું સૌભાગ્ય હશે.

- શ્રી લલિતજી ગાંધી (રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય જૈન અલ્પસંખ્યાંક મહાસંઘ)

સુવાક્ય

भवदुस्त्रतावियाणं रागाईविविहरोगदुहियाणं।
जीवाण निव्वुइकरं जिणवयणं जयउ अमियमयं॥

- उत्तराध्ययननिर्युक्ति प्रत, (विजयगच्छ भंडार, राधनपुर)

અમૃત જેવું જિનવચન જીવોનો સંસારનો તાપ શમાવે છે.
રાગ આદિ વિવિધ રોગોનું દુઃખ દૂર કરે છે. તેનો જય હો.

Printed Matter

Posted under clause 121 & 114 (7) of P & T Guide

To,

From : Shrutbhavan Research Centre
(Initiation of Shrutdeep Research Foundation)

47/48, Achal Farm, Nr. Sachchai Mata Mandir, Ahead of Jain Agam Temple, Katraj, Pune-411046
Mo. 07744005728 Email : shrutbhavan@gmail.com Website : www.shrutbhavan.org

For Informative and Inspirational
speeches about Shrut
please subscribe our Shrutbhavan
YouTube channel